S AGYOS AAVAS FINANCIERS LIMITED (Formerly known as Au HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2011PLCO34297 Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020 Demand Notice Under Section 13(2) of Securitisation Act of 2002

As the Loan Account Became NPA therefore The Authorised Officer (AO) Under section 13 (2) Of Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act 2002 had issued 60 day demand notice to the borrower as given in the table. According to the Notice if the Borrower does not deposit the Amount within 60 days, the amount will be recovered from Auction of the security as given below. As the demand Notice send to the borrower/guarantor has not been served, copy of demand notice has also been affixed on the secured assets as given below. Therefore you the borrower is informed to deposit the loan amount along with future interest and recovery expenses within 60 days, otherwise under the provisions of section 13 (4) and 14 of the said Act, the AO is

| free to take possession of the Security as given below.  |  |  |  |  |  |  |  |  |
|--|--|--|--|--|--|--|--|--|
| Name of the Borrower Date and Amount of Demand Description of Mortgaged property Notice Under Sec. 13(2)   |  |  |  |  |  |  |  |  |
| Mrs. Asmitaben Vipulbhai Rangani,<br>Mr. Vipulbhai Vitthlbhai Rangani<br>(A/c No.) LNSUR02218-190090125  | 12-Nov-19<br>Rs. 4035557/-<br>11-Nov-19    | Block No. 182, Revenue Survey No. 227/2, 228, 229, 244, 239, Plot No 45 paiki, Block No. 182/B/45, "Maple Villa" Moje Kathor, Sub-Dist. & Taluka Kamrej, Dist. Surat, Gujarat. Admeasuring 114.01 Sq. Mtrs. and Admeasuring 23.23 Sq. Mtrs. in Road & COP Total Admeasuring 137.24 Sq. Mtrs.             |  |  |  |  |  |  |
| Mr. Bharat Dhirajlal Chauhan,<br>Mrs. Bhartiben Chauhan,<br>Mr. Ravi Bharatbhai Chauhan,<br>Mrs. Nilamben Ravibhai Chauhan<br>(A/c No.) LNSUR00317-180056949 | 12-Nov-19<br>Rs. 3802301/-<br>11-Nov-19    | Revenue Survey No. 356 & 357, Block No. 343, Bungalow No. 247,<br>'Swapna Villa' Society, Moje – Kamrej, Taluka & Sub-District –<br>Kamrej, District – Surat, Gujarat. Admeasuring 71.53 Sq. Mtrs.<br>Construction Admeasuring 125.41 Sq. Mtrs. alongwith<br>undivided share Admeasuring 49.59 Sq. Mtrs. |  |  |  |  |  |  |
| Mrs. Lilaben Parashotambhai Ginoya,<br>Mr. Ginoya Parshotambhai<br>Goradhanbhai, Mr. Ketanbhai<br>Parshotambhai Ginoya<br>(A/c No.) LNRAK00318-190083940     | 12-Nov-19<br>Rs. 2079499/-<br>11-Nov-19    | Revenue Survey No. 281/paiki/3, Sub Plot No. 75 To 81/5, Shiv<br>Nagar Park, Moje - Kothariya, Tal & District - Rajkot, Gujarat.<br>Admeasuring 56.146 Sq. Mtrs.   |  |  |  |  |  |  |
| Mrs. Vijyaben Rameshbhai Savaniya,<br>Mr. Rameshbhai Savaniya<br>(A/c No.) LNJUN02217-180061177  | 12-Nov-19<br>Rs. 2484523.41/-<br>11-Nov-19 | Revenue Survey No. 53 paiki 1, Plot No. 22, Umiya Nagar-2,<br>Gram - Keshod, Sub-District – Keshod, District – Junagadh,<br>Gujarat. Admeasuring 256 Sq. Mtrs.   |  |  |  |  |  |  |
| Place: Jaipur Date: 14.11.201  | 9  | Authorised Officer Aavas Financiers Limited  |  |  |  |  |  |  |

# **MUTHOOT HOMEFIN (INDIA) LTD**

CIN - U65922KL2011PLC029231 CORPORATE OFFICE: 1201 & 1202, 12<sup>th</sup> Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai – 400 063. SURAT BRANCH: No. 208, 2nd Floor 21st Century Business Centre House, B/s. World Trade Centre, Ring Road Surat - 395002, Gujarat

#### **CORRIGENDUM**

This is with reference to sale notice published on 05th November 2019, due to typographic error wrong auction dates were published. Notice is hereby given to public at large that earlier sale notice publication dated 05th November 2019 is hereby recalled and a revised auction notice to be considered as below:-

### APPENDIX-IV-A [See proviso to rule 8(6)] PUBLIC NOTICE FOR AUCTION CUM SALE

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the physical possession, on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever

| Sr. |  | Demand  | Description of the   | Reserve   | Earnest Money   |
|-----|--|---|--|---|---|
| No. | Guarantor(s) /<br>Loan Account No.   | Notice Date<br>and Amount   | Immovable property   | Price<br>(RP)   | Deposit (EMD)<br>(10% of RP)  |
| 1   | Santokram Sakaram Bos<br>(Applicant)<br>Masaruben Sakaram Bos<br>(Co-Applicant)<br>004-00402000 / Surat  | 21-Jan-19 / Rs. 3,68,504/-<br>(Rupees Three Lac Sixty<br>Eight Thousand Five<br>Hundred Four Only)  | Flat No. 60, 4th Floor, Building-J, admeasuring 195 sq. fts. area, in the Building known as "Patel Township", situated at Block No. 122/B, Near Astorn Palace, Village Velanja, Tal. Kamrej, Dist. Surat – 394130. Gujarat. More particularly mentioned in the Sale Deed Registration No. 27030, Dated 13/12/2017 in the office of Joint Sub Registrar Kamrej. | Rs. 3,07,220/-<br>(Rupees Three Lac<br>Seven Thousand<br>Two Hundred<br>Twenty Only)          | Rs. 30,722/-<br>(Rupees Thirty<br>Thousand Seven<br>Hundred Twenty<br>Two Only)       |
| 2   | Santoshbhai Parasnath<br>Upadhyay (Applicant)<br>Chandrakaladevi<br>Santoshbhai Upadhyay<br>(Co-Applicant)<br>004-00401647 / Surat   | Upadhyay (Applicant) Chandrakaladevi Santoshbhai Upadhyay (Co-Applicant)  (Co-Applicant)  (Rupees Seven Lac Ninety Eight Thousand Three Hundred Twenty Only)  (Co-Applicant)  (Rupees Seven Lac Ninety Eight Thousand Three Hundred Twenty Only)  Nos.115,116,117,118,119 & 120 of "Aradhana Lake Town Vibhag-4" constructed & situated on the land bearing new block No.13 & 14 of |  | Rs. 5,30,000/-<br>(Rupees Five Lac<br>Thirty Thousand<br>Only)                                | Rs. 53,000/-<br>(Rupees Fifty<br>Three Thousand<br>Only)                              |
| 3   | Pateliya (Applicant) Sumitraben Natvarbhai Pateliya Nine Only)  (Rupees Six Lac Sixty Six Thousand Five Hundred Nine Only)  Surat Mumbai Highway Moje Palsana Surat-394315 Gujrat (Plot No. 187 (Flot No. 187))  & 188 Respectively admeasuring 75.13 sq Mtrs.), More Particularly Mentioned in the Sale Deed No 7185 Dated 23.03.2018 registered at T   |   | Rs. 4,73,750/-<br>(Rupees Four Lac<br>Seventy Three<br>Thousand Seven<br>Hundred Fifty<br>Only)  | Rs. 47,375/-<br>(Rupees Forty<br>Seven Thousand<br>Three Hundred<br>Seventy Five Only)        |   |
| 4   | Sanjaybhai Hirabhai<br>Jatapara (Applicant)<br>Gitaben Sanjaybhai<br>Jatapara (Co-Applicant)<br>004-00401720 / Surat   | 30-Mar-19 / Rs. 13,25,825/-<br>(Rupees Thirteen Lac<br>Twenty Five Thousand Eight<br>Hundred Twenty Five Only)  | 314, 3rd Floor, Suryavanshi Flats, Behind Sarvotam Hotel, Bagumara,<br>Palsana, Surat, Gujarat, 394305   | Rs. 9,15,500/-<br>(Rupees Nine Lac<br>Fifteen Thousand<br>Five Hundred Only)                  | Rs. 91,550/-<br>(Rupees Ninety<br>One Thousand<br>Five Hundred Fifty<br>Only)         |
| 5   | Satishkumar Prahlad<br>Singh (Applicant)<br>Prahlad Ramakant Singh<br>Ranjudevi Prahlad Singh<br>(Rakesh Prahlad Singh<br>(Co-Applicant)<br>004-00402917 / Surat   | (Rupees Thirteen Lac Thirty Ramakant Singh Thousand Three Hundred Prahlad Singh Phalad Singh Applicant)  (Rupees Thirteen Lac Thirty Behind S D Jain School, Highway No.8, Surat Mumbai Highway, Palsana, Surat, Gujarat-394315  Palsana, Surat, Gujarat-394315   |  | Rs. 8,32,050/-<br>(Rupees Eight Lac<br>Thirty Two<br>Thousand Fifty<br>Only)                  | Rs. 83,205/-<br>(Rupees Eighty<br>Three Thousand<br>Two Hundred Five<br>Only)         |
| 6   | Mansukh Gadubhai<br>Gajera (Applicant)<br>Jiviben Gadubhai Gajera<br>(Co-Applicant)<br>004-00401554 / Surat  | Gajera (Applicant)  Jiviben Gadubhai Gajera (Co-Applicant)  Hundred Fifty Nine Only)  (Rupees Twenty Three Lac Eighty Five Thousand Eight Hundred Fifty Nine Only)  - 394110. Gujarat. More particularly mentioned in the Sale Deed   |  | Rs. 10,41,000/-<br>(Rupees Ten Lac<br>Forty One<br>Thousand Only)                             | Rs. 1,04,100/-<br>(Rupees One Lac<br>Four Thousand<br>One Hundred<br>Only)            |
| 7   | Tribhuvanbhai<br>Thakarshibhai Koradiya<br>(Applicant)<br>Manjuben Tribhuvanbhai<br>Koradiya (Co-Applicant)<br>004-00402642 / Surat  | Tribhuvanbhai 09-Feb-19 / Rs. 10,71,853/- Flat No.402, Adm 558 Sq. Fts.,4th Floor,Arihant Residency,Harinath Park (Rupees Ten Lac Seventy One Thousand Eight Hundred Fifty Three Only)  Manjuben Tribhuvanbhai Koradiya (Co-Applicant)  Manjuben Tribhuvanbhai Koradiya (Co-Applicant)  |  | Rs. 6,37,350/-<br>(Rupees Six Lac<br>Thirty Seven<br>Thousand Three<br>Hundred Fifty<br>Only) | Rs. 63,735/-<br>(Rupees Sixty<br>Three Thousand<br>Seven Hundred<br>Thirty Five Only) |
| 8   | Lalit Rajmani Dubey<br>(Applicant)<br>Asha Lalit Dubey<br>(Co-Applicant)<br>004-00404707 / Surat   | (Applicant) (Rupees Nine Lac Twenty Asha Lalit Dubey (Co-Applicant) Three Only) No.88/BSai Deedp Residency Near Aaradhana Industrial Estate- Surat Bardoli Road Surat-Gujarat-394310.More Particularly mentioned in the Sale Deed No.12464/2018 dated 5/06/2018 having regstration  |  | Rs. 6,20,275/-<br>(Rupees Six Lac<br>Twenty Thousand<br>Two Hundred<br>Seventy Five Only)     | Rs. 62,028/-<br>(Rupees Sixty<br>Two Thousand<br>Twenty Eight<br>Only)                |
| 9   | Ramesh Shankar Mahto (Applicant) Laxmi Devi Ramesh Mahto (Co-Applicant) (Co-Applicant) 004-00403921 / Surat  23-Mar-19 / Rs. 9,00,025/- (Rupees Nine Lac Twenty Five Only) Flat No. 303 3rd Floor, Adm.616.Sq.Fts.Dharmanandan Residency Soni Park Housing Society-2, Tatithaya Palsana Surat Gujrat, More Particularly Mentioned in the Sale Deed No 9319 Dated 11.04.2018 registered at Sub-Registrar Office Sub-Registrar Palsana |   | Rs. 5,69,875/-<br>(Rupees Five Lac<br>Sixty Nine<br>Thousand Eight<br>Hundred Seventy<br>Five Only)  | Rs. 56,988/-<br>(Rupees Fifty Six<br>Thousand Nine<br>Hundred Eighty<br>Eight Only)           |   |
| 10  | Nageshwar Rao Chaipuri<br>(Applicant)<br>Malehvari Nageshwar<br>Chaipuri<br>(Co-Applicant)<br>004-00000294 / Surat   | 28-Mar-19 / Rs. 6,67,755/-<br>(Rupees Six Lac Sixty<br>Seven Thousand Seven<br>Hundred Fifty Five Only)   | Flat No. 307, Madhav Residency, Block No. 2, Plot No. 294 to 296, Soni<br>Park Housing Society-2, Near Tantithaiya Bus Stand, Off. Surat-Baroli<br>Road, Village Tantithaiya, Tal. Palsana,  | Rs. 4,01,425/-<br>(Rupees Four Lac<br>One Thousand Four<br>Hundred Twenty<br>Five Only)       | Rs. 40,143/-<br>(Rupees Forty<br>Thousand One<br>Hundred Forty<br>Three Only)         |
| 11  | Sunilkumar Ramlakhan<br>Tiwari (Applicant)<br>Mitu S Tiwari<br>(Co-Applicant)<br>004-00402864 / Surat  | 8-Apr-19 / Rs. 7,77,785/-<br>(Rupees Seven Lac Seventy<br>Seven Thousand Seven<br>Hundred Eighty Five Only)   | Flat No. 516, 5th Floor, Times Square Residency, Off Surat Kadodara<br>Road, Vareli, Palsana, Surat, Gujarat-394140.   | Rs. 4,18,550/-<br>(Rupees Four Lac<br>Eighteen Thousand<br>Five Hundred Fifty<br>Only)        | Rs. 41,855/-<br>(Rupees Forty<br>One Thousand<br>Eight Hundred<br>Fifty Five Only)    |

- 1. The Auction is being held on "AS IS WHERE IS" AND "AS IS WHAT IS" basis 2. The detailed terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form, available at the above mentioned regional office
- 3. Last Date of Submission of Sealed Bid/Offer in the prescribed tender forms along with EMD payable by way of Demand Draft in Favor of Muthoot Homefin (India) Ltd'.along with KYC is on 26" December 2019 till 4:00 PM at the Regional Office address mentioned herein above. Tenders that are not filled up completely or tenders received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
- 4. Date of Inspection of the Immovable Property is on 23th November 2019 between 1.00 P.M to 3.00 PM. 5. Date of Opening of the Bid/Offer Auction Date for Property is 27<sup>th</sup> December 2019 at the above mentioned Regional Office address at 1:00 PM. by the Authorised Officer.
- 6. The MHIL shall not be responsible for payment of any outstanding statutory notice & Encumbrances / taxes arrears etc. if any & their Responsible to pay the sum would be
- that of the Successful auction purchase. The Intending bidder should make their own independent inquiries regarding the Encumbrances Title of property & also inspect 8
- 7. The Highest bidder shall be subject to approval of MHIL Ltd. Authorised Officer shall Reserve the right to accept all any of the offer /Bid so received without assign any reason whatsoever. His decision shall be final and binding. 8. The Borrower(s)/Guarantor(s) are hereby given 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 to pay the sum mentioned as above before the date of Auction

failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to Muthoo Homefin (India) Ltd, in full, before the date of sale, auction is liable to be set aside. For further details, contact the Authorised Officer, at the above mentioned Office address Contact Person - Devang Desai-9428266235

Place: Gujarat Date: 14.11.2019

Authorized Officer, Muthoot Homefin (India) Limited

### BETEX INDIA LIMITED

504, TRIVIDH CHAMBERS, 5th FLOOR, Opp. FIRE STATION, RING ROAD, SURAT-395002, INDIA. Ph.: (91-261) 2328902, FAX: (91-261) 2334189, E-mail: corporate@betexindia.com

EXTRACT OF STANDALONE UN AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2019

|            |  |                   |                    |                  | (Rs In Lacs)  |
|------------|--|-------------------|--------------------|------------------|---------------|
| Sr.<br>No. | PARTICULARS  | QUARTER<br>ENDED  | HALF YEAR<br>ENDED | QUARTER<br>ENDED | YEAR<br>ENDED |
|            |  | 30/09/2019        | 30/09/2019         | 30/09/2018       | 31/03/2019    |
|            |  | <b>Un-Audited</b> | Un-Audited         | Un-Audited       | Audited       |
| 1.         | Total Income from operations (net)   | 1332.41           | 2634.83            | 1214.12          | 4679.82       |
| 2.         | Net Profit / (Loss) for the period (before Tax,  |                   |                    |                  |               |
|            | Exceptional and/or Extraordinary items)  | 13.61             | 28.36              | 41.62            | 96.71         |
| 3.         | Net Profit / (Loss) for the period before tax (after   |                   |                    |                  |               |
|            | Exceptional and/or Extraordinary items)  | 13.61             | 28.36              | 41.62            | 96.71         |
| 4.         | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)                | 9.25              | 18.56              | 45.74            | 98.12         |
| 5.         | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other |                   |                    |                  |               |
|            | Comprehensive Income (after tax)]  | 9.25              | 18.56              | 45.74            | 98.12         |
| 6.         | Equity Share Capital   | 150.00            | 150.00             | 150.00           | 150.00        |
| 7.         | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year        |                   |                    |                  | 2076.28       |
| 8.         | Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)                          |                   |                    |                  |               |
|            | 1. Basic :<br>2. Diluted :   | 0.62              | 1.24               | 3.05             | 6.54          |
|            | Z. Diluteu .   |                   |                    |                  |               |

The above is an extract of the detailed format of Quarterly Financial Results for the quarter ended 30th September, 2019, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company's website : www.betexindia.com

for **BETEX INDIA LIMITED** Place: Surat sd /-MAHESH SOMANI (Chairman) Date: 13/11/2019

## Is your opinion yours?

Your opinion should belong to you.

A voice that is your own.

Undeterred. Uncompromised. And brave.

A conscience that isn't at peace,

until the truth is uncovered.

A mind that isn't fuelled by

and not ignorant assumptions.

someone else's thoughts. Where actions are based on informed opinions

Because it's not about going where everyone goes. Or being part of a trend because it is one.

Or taking sides because you don't know enough.

It's about freedom.

The freedom to have an opinion that's yours.

At Indian Express, we stand by this freedom. We celebrate it by being unbiased and independent. And by having a voice that isn't afraid to speak its mind.

#InformYourOpinion

The Indian Express. For the Indian Intelligent.



indianexpress.com

*♦ The Indian EXPRESS* 

#### AMOL MINECHEM LIMITED

(Formerly known as Amol Dicalite Limited) Registered Office / Corporate Office: 401, 'Akshay', 53, Shrimali Society,

Navrangpura, Ahmedabad-380 009 (India) Phone: +91-79-40246246, 26560458. Fax: +91-79-26569103. E-mail: info@amolminechem.com CIN: L14100GJ1979PLC003439. Website: www.amolminechem.com

NOTICE

#### (FOR TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) SUSPENSE ACCOUNT)

Members are hereby informed that in accordance with the provisions of Section 124 (6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, (Rules), Equity shares of the Company, in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more are required to be transferred by the Company to IEPF Suspense Account of the Government of India.

As per the records of the Company, unclaimed/unpaid dividend for the financial year 2011-12 shall be transferred to IEPF as required under Section 124 (5) of the Companies Act, 2013. Adhering to the various requirements set out in the Rules, the Company has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Suspense Account under the said Rules for taking appropriate actions. The Company has also uploaded the details of such shareholders on its website. Shareholders are requested to check the details.

Shareholders may note that both the unclaimed/unpaid dividend and the shares transferred to IEPF Authority/ Suspense Account including all benefits accruing in such shares, if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed by the Rules The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Suspense Account, may note that the Company would be issuing duplicate share certificates in lieu of the original share certificates held by them for the purpose of transfer of shares to IEPF Suspense Account as per Rules and upon such issue, the original certificates which stand registered in their name will stand automatically cancelled and be deemed nonnegotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed to be adequate notice in respect of issue of the duplicate share certificates by the Company for the purpose of transfer of shares to IEPF Suspense Account pursuant to the Rules.

In case the shareholders have any queries on the subject matter and the Rules, they may contact the company's Registrar and Share Transfer Agent at Link Intime India Pvt. Ltd. 5th Floor, 506 TO 508, Amarnath Business Centre-1(ABC-1), Beside Gala Business Centre, Off C G Road, Navrangpura Ahemdabad-380009, Tel.: 079-26465179, E-mail: iepf.shares@linkintime.co.in.

For Amol Minechem Ltd. Sd/-

Place: Ahmedabad Date: 12.11.2019

Shreyas Sheth Managing Director (DIN 00009350)

PRASHANT INDIA LIMITED REGD. OFFICE- BLOCK NO 456, PALSANA CHARRASTA, PALSANA, DIST SURAT, GJ 394315, PH-9375055557 CIN: L15142GJ1983PLC006574
STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER & HALF YEAR ENDED 30.09.2019.

| Particulars  | Quarter ended<br>30.09.2019<br>Unaudited | Quarter ended<br>30.09.2018<br>Unaudited | Half Year ended<br>30.09.2019<br>Unaudited | Year ended<br>31.03.2019<br>Audited |
|--|--|--|--|-------------------------------------|
| Total income from operations (net)   | 42.03                                    | 18.10                                    | 89.29                                      | 105.47                              |
| Net Profit / (Loss) from ordinary activities after tax                                     | 3.49                                     | 3.50                                     | 6.98                                       | 110.15                              |
| Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)                   | 45.52                                    | 21.60                                    | 96.27                                      | 215.62                              |
| Equity Share Capital   | 423.54                                   | 423.54                                   | 423.54                                     | 423.54                              |
| Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)    |  |  |  | (3660.68)                           |
| Earnings Per Share (before extraordinary items)<br>(of Rs. 10/- each)<br>Basic & Diluted : | 0.25                                     | (0.37)                                   | 0.38                                       | 2.62                                |
| Earnings Per Share (after extraordinary items)<br>(of Rs. 10/- each)<br>Basic & Diluted :  | 0.25                                     | (0.37)                                   | 0.38                                       | 2.62                                |

Note: The above is an extract of the detailed Quarterly and yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the Stock Exchange websites at www.bseindia.com

For Prashant India Limited Date: 13.11.2019 Sd/- Authorised Signatory



(Rs. In lakhs)

सेन्ट्रल **अं**ङ **ओ**ङ छन्डिया सेन्ट्रल बेंक ऑफ इंडिया **Central Bank of India** 

રીજીયોનલ ઓફિસ : લાલદ૨વાજા. અમદાવાદ-૩૮૦ ૦૦૧.

પઝેશન નોટીસ

{પરિશિષ્ટ-૪ નિચમ ૮(૧)} (स्थावर भिલકत भाटे)

ઝાથી, નીચે સહી કરનાર **સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, કાંકરીયા શાખા** ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટર એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ સાથે વંચાણે લેતા અંતર્ગત **તા. ૩૧.૦૧.૨૦૧૯** ના રોજ ડિમાન્ડ નોટીસ દ્વારા ઉધારકર્તા મે. રોનક પ્રિન્ટર્સ અને પેકેજીંગ (તેના પ્રોપરાઇટર) શ્રી રાકેશકુમાર ગોવિંદભાઈ પટેલ (પ્રોપરાઈટર) ૨. શ્રી રાકેશકુમાર ગોવિંદભાઈ પટેલ (ગિરવેદાર)ને નોટીસમાં જણાવેલ ૨કમ **રા. ૧૦,૬૯,૦૪૩/- (રા. દસ લાખ ઓગણસિતેર હજાર તેતાલીસ પુરા)** ચડત વ્યાજ અને નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં ચુકવવા જણાવવામાં આવ્યું હતું. ઉદ્યારકર્તા ને ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉદ્યારકર્તા અને

જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ પેટા કલમ (૪) અને કલમ ૧૩ તથા નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ <mark>તા. ૦૯.૧૧.૨૦૧૯</mark>ના રોજ નીચે જણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઈ લીધેલ છે.

ઉદ્યારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે નીરે ર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં અને મિલકતનો સોદો કરશે તો તે **સેન્ટ્રલ બેંક ઓફ** ઈન્ડિયા, કાંકરીયા શાખા ના બાકી લેણા રૂા. ૧૦,૬૯,૦૪૩/- (રૂા. દસ લાખ ઓગણસિતેર **હજાર તેતાલીસ પુરા**) તા. ૩૦.૦૧.૨૦૧૯ ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ચાર્જીસ ને આધિન રહેશે. (૧૩ (૨)ની ડિમાન્ડ નોટીસ આપ્યા પછી આવેલ રકમ બાદ કરીને)

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્ચાદામ સેક્સન ૧૩ના સબ સેક્શન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

સ્થાવર મિલકતની વિગત

શ્રી રાકેશકુમાર ગોવિંદભાઈ પટેલના નામની ગિરવે મુકેલ મિલકત જે ફલેટ નં. સી-૧૫, બીજો માળ, પાચલ પ્લાઝા, પાણી ટાંકી પાસે, મહાવીર નગર રોડ, હીરાવાડી સૈજપુર બોઘા, અમદાવાદ, પ્લોટ નં. ૨૧૮૪ પૈકી, સર્વ નં. ૩૪૦/બી/૧, ટી.પી. સ્કીમ નં. ૪૮ (ડ્રાફ્ટ), એફ.પી. નં. ૧૮/૯, મૌજે–સૈજપુર બોઘા, તાલુકા–અસારવા અમદાવાદ, ગુજરાત ખાતે આવેલ મિલકત. ક્ષેત્રફળ ૨૨.૧૯ સ્કે. મીટર

**ચતુરસીમા**ઃ \varTheta પુ**ર્વે** ઃ ફલેટ નં. ૧૨ **● ઉત્તરે** : સીડી

**● પશ્ચિમે** : સિતવન રો-હાઉસ **● દક્ષિણે** : ફ્લેટ નં. ૧૪

સહી/

અધિકૃત અધિકારી,

તારીખ : ૦૯.૧૧.૨૦૧૯ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સ્થળ : અમદાવાદ

### o ZONE WORLD LIMITED

Registered Office : 501/1, Parshwa, Opp. Rajpath Club, S. G. Highway, Bodakdev, hmedabad - 380054 **CIN** : L65910GJ1989PLC012835 **Phone No**. 079 - 26873755 Fax No. 079 - 26871756 Website: www.ozoneworld.in Email: ozoneworldltd@gmail.co

| Extract of Unaudited Standalone Financial Result for the Quarter and Half Year ended on 30" September, 2019 |               |               |                    |                    |  |  |  |  |
|---|---------------|---------------|--------------------|--------------------|--|--|--|--|
|   |               |               |                    | (₹ In Lacs)        |  |  |  |  |
| Particulars   | Quarter ended | Quarter ended | Half Year<br>ended | Half Year<br>ended |  |  |  |  |
|   | 30-09-2019    | 30-09-2018    | 30-09-2019         | 30-09-2018         |  |  |  |  |
| Total Income from operations  | 16.27         | 14.93         | 32.80              | 29.82              |  |  |  |  |
| Net Profit / (Loss) from ordinary   | 8.46          | 9.47          | 19.83              | 20.17              |  |  |  |  |
| activities after tax  |               |               |                    |                    |  |  |  |  |
| Total Comprehensive income for the  | 8.46          | 9.47          | 19.83              | 20.17              |  |  |  |  |
| period (Comprising profit for the   |               |               |                    |                    |  |  |  |  |
| period and Other Comprehensive  |               |               |                    |                    |  |  |  |  |
| Income for the period) after tax  |               |               |                    |                    |  |  |  |  |
| Equity Share Capital  | 369.91        | 369.91        | 369.91             | 369.91             |  |  |  |  |
| Earnings Per Share (of Rs. 10/- each)   |               |               |                    |                    |  |  |  |  |
| Basic :   | 0.23          | 0.26          | 0.54               | 0.55               |  |  |  |  |
| Diluted :   | 0.23          | 0.26          | 0.54               | 0.55               |  |  |  |  |
|   |               |               |                    |                    |  |  |  |  |

Note: 1.The above is an extract of the detailed quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full result of the Quarterly Results is availalbe or the stock exchange website (www.bseindia.com) and also available on the Company

vebsite www.ozoneworld.in Place: Ahmedabad Date: 12th November, 2019

FOR OZONE WORLD LIMITED JAYESHKUMAR PATEL MANAGING DIRECTOR(DIN: 00907313)

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા ુ .ઓ. ૧૧, હેમન્તા બાસુ સરાણી, કોલકતા -७૦૦ ૦૦૧ અમદાવાદ રિજીચન, લાલ દરવાજા, બીજો માળ, યુનાઇટેડ બેંક બિલ્ડીંગ,

ક્લિજાની નોટિસ (સ્થાવર મિલકત માટે) Appendix-IV આથી, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ દા સિક્યોરીટાઇગ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એરોટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ ૨૦૦૨ના ૫૪)અને સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) હેઠળ નિચમ ૩ સાથે વાંચલા પ્રાપ્ત થયેલા અધિકાર મુજબ તા.૧૩-૦૬-૦૧૬ ન િગ્યમ ૩ સાથે વાંચલા પ્રાપ્ત થયેલા અધિકાર મુજબ તા.૧૩-૦૬-૦૧૬ ન રોજ માંગણા નોટિસ જારી કરેલ હતી, જે અનુસાર બેંકના ૠણકર્તા(ઓ)- શ્રી સદામ હુસેન દોસ્ત મામદ જોખીયા (ૠણકર્તા), અને શ્રી દોસ્ત મામદ જોખીયા (સહ ૠણકર્તા) રહેવાસી ૫૦/૩, વૈશાલીનગર, સ્ટ્રીટ નં.૩, ઘારાનગર-૧, ડાંગરવાડા, રેલ્વે ક્રોસિંગ પાસે, જમનગર, ગુજરાત-૩૬૧૦૦૨ ને નોટિસમાં જણાવ્યા મુજબ બેંકના લેણાંની ટક્મ રા.૯,૩૫,૯૩૪.૦૦ (રુપિયા નવ લાખ પાંત્રીસ હજાર નવસો યોંત્રીસ ખુરા તા.3૧-૦૫-૨૦૧૯ના રોજ) વતા તા.૧૫-૦૫-૨૦૧૯ સુધી ચડતું ત્યાજ, રાર્જીસ અને તેની પરના અન્ય ખર્ચા વગેરે આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂકવવા જણાવેલ. ૠણકર્તા બેંકની લેણી ૨૬મ પરત કરવામાં નિષ્ફળ જવાથી, ખાસ ૠણકર્તાને અને જાહેર જનતાને આથી નોટિસ આપવામાં આવે छे डे -सहर डायहानी डलम १३(४)अने ध सिड्योरिटी छन्टरेस्ट (अन्ड्रेस्मिन्ट) रुक्त २००२ना नियम नं. ८ साथे वांचता मुणेल सत्तानी ऋसे नीचे सही કરનાર અધિકૃત અધિકારીએ **તારીખ ૧૧-૧૧-૨૦૧૯ ના રોજ** નીચે જણાવેલ મિલકતનો **કબજો** મેળવી લીધેલ છે. "ૠણકર્તા ને સેક્શન ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ અનુસાર સુરક્ષિત મિલકતોને બચાવવા માટે પ્રાપ્ય થતા સમય અંગે ધ્યાન દોરવામાં આવે છે."

ૠણકર્તાને ખાસ અને જાહેર જનતાને સામાન્યતઃ ચેતવણી આપવામાં આવે છે નીચે જણાવેલ મિલકત/મિલકતો સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર કરવો હી અને તે મિલકત/મિલકતો અંગેનો કોઇપણ પ્રકારનો વ્યવહાર **યુનાઇટેડ બેંક મોક્ ઇન્ડીયા** ના લેણાં **રા.૯,૩૫,૯૩૪.૦૦** વત્તા તેની પર ચડતું વ્યાજ વગેરે બોજાને આઘીન રહેશે.

स्थावर भिसङतनुं वर्शन :

શ્રી સદામ હુસેન દોસ્ત મામદ જોખીયાની માલિકીની મિલકતનું મોર્ગેજ- ફ્રી હોલ્ડ (રહેણાંક) લેન્ડ એન્ડ બિલ્ડીંગ, પ્લોટ નં. ૯૭/એ, સર્વે નં. ૨૧૪૭/૯૭/૧, શીટ નં.૧૯૯, વોર્ડ નં. ૧૧, આદિત્ય પાર્ક, જામનગર, ક્ષેત્રફળ ૫૬ ચો.મી. સેલ ડીડ નં. ૩૪૬૬ તા.૧૮-૦૬ ૨૦૧૬, ક્ષેત્રફળ એરીયા ૪૫.૨૨ ચો.મી. બ્લિટ અપ એરીયા સાથે,

કે જેની ચતુઃસીમાઃ-પૂર્વ ૭.૫ મીટર પહોળો રોડ, પશ્ચિમે સબ પ્લોટ નં.૭૫,

ઉત્તરે સબ પ્લોટ નં. ૯૭/બી, દક્ષિણે પ્લોટ નં.૯૫ અને ૯૬/ઇ.

તારીખ : ૧૧-૧૧-૨૦૧૯

(સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ, ૨૦૦૨ના નિયમ –૮(૧) हેઠળ) **કબજા નોટિસ (અ**ચલિત મિલકત માટે)

આથી, અલ્ફાબાદ બેંક, ગાંઘીધામ શાખા, કચ્છના અધિકારી અધિકારીએ સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સટ્રકશન ઑક ફાચનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ડ્રોસેમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (૨૦૦૨ નો એક્ટ ને ૫૪) તથા સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ડ્રોસેમેન્ટ) નિયમ, ૨૦૦૨ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) સાથે વંચાતા નિયમ ૩ અતર્ગત સિક્ચુરીટી ઇન્ટરેસ્ટ (એન્ડ્રોસેમેન્ટ) નિયમ, ૨૦૦૨ સાથે મળેલી સત્તાના ગુએ નીચે સહી કરના અધિકારીએ તો. ૩૦.0%.૨૦૧૯ના રોષ કિમાન્ડ નીટિસ જારી કરેલ તદી કે જેમાં કરપદાર મી અન્યાં ગોપાલ ક્યાલ (કરપદાર અને ગીરોકર્તા) અને મી ૨૪ત વિજય વાલીયા (જામીનદાર) ને નીટીસમાં જણાવેલ બાકી ૨૬મ રૂા. ૨૩,૪૯,૩૦૪ (રૂપિયા ત્રેવીસ લાખ એગણપચાસ ફજાર ત્રણસો ચારમાત્ર) તા. ૨૯.૦૭.૨૦૧૯ સુધીના સદર નીદિસ પ્રાપ્ત થયાની તારીખાર્ચ 9 દરિસ્તમાં ચુંટવાવ જણાવવામાં આવ્યું હતું. કરજદાર/ગીરોદરા/જામીનદાર આ ૨૬મ ચુકવવામાં નિષ્ફળ ગયેલ દીવાથી કરજદાર તેમજ સામાન્ય રીતે જાહેર જનતાને નીટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે નીચે દર્શાય ભાવત 1.04.૧,૧૦૧૯ ના એજ મિલકતનો કબ્જો

કલમ ૧૩(૪) સાથે (વંચાણે લેતા નિયમ ૮) हેઠળથી સત્તાઓ મુજબ તા. **૦૫.૧૧.૨૦૧૯** ના રોજ મિલકતનો **કબજો** 

લઈલીઇલ છે. આથી વિશેષપણે કરજદાર તથા સામાન્ય જનતાને આ મિલકત અંગે કોઇપણ વ્યવહાર નહીં કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત અંગેનો કોઇ પણ વ્યવહાર અલ્ફાબાદ બેંક, ગાંઘીઘામ શાખા, કચ્છની બાકી ક્ષમ રૂા. ૨૩,૪૯,૩૦૪ (રૂપિયા ત્રેવીસ લાખ ઓગણપચાસ કૃષ્મર ત્રણસો ચાર માત્ર) તા. ૨૯.૦૭.૨૦૧૯ મુધીના અને ત્યારબાદના વ્યાજ અને ખર્ચની રકમના બીજાને આધિન રહેશે. સદરહુ કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે કરજદારોનું મુકરર મિલકત છોડાવવા માટે નળવાપાત્ર સમય બાબતે ધ્યાન દીરવામાં આવે છે.

અચલિત મિલકતની વિગત

અલાવતા નાલકતના 1નગત રહેણાંક ફલેટ નં. એસ-૨ (બિલ્ટ અપ વિસ્તાર સેત્રફળ ક3.૮૨ ચો.મી.), બીજો માળ, મુખ્ય પ્લોટ નં. ૪૦૬, લોર્ક નં. ૩/એ, પરકેક્ટ ઓનર્સ એશોસીએશન (આદિપુર), આદિપુર, તાલુકો ગાંધીધામ, જીલો કચ્છ, રાજય ગુજરાત અને ત્યાં થયેલ બાંધકામ જે શ્રી અનેતા ગોપાલ રાયમાં નામની અચલિત મિલકત તેના તમામ ક્રક અને ફિસ્સ માથે. મિલકતની ચતુર્સીમાં આ મુજબ : ઉત્તર : દાદરા અને ક્લેટ નં. એસ-૩, દક્ષિણ : ખુલી જગ્યા, પૂર્વ : ખુલી જગ્યા, પશ્ચિમ : ફલેટ નં. એસ-૧, એસએક.

ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી, અલ્હાબાદ બેંક

તારીખ : ૦૭/૧૧/૨૦૧૯ સ્થળ : ગાંધીધામ

યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા

ઝેચ. ઓ. ૧૧, હેમન્તા બાસુ સરાણી, કોલકતા -હ૦૦ ૦૦૧ ઃ અમદાવાદ રિજીયન, લાલ દરવાજા, બીજો માળ, યુનાઇટેડ બેંક બિલ્કીંગ, ङ्खलानी नोटिस (સ્થાવર મિલકત માટે) Appendix-IV

આથી, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયાના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ ઇ સિક્યોરીટાઇપ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એરોટ્સ એન્ડ એન્ફોરિમેન્ટ ઑફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ ૨૦૦૨ના ૫૪)અને સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) દેઠળ ારાકવાસ્ટા ઇન્ટરસ્ટ (અન્ફારામન્ટ) કહેરા ૨૫૦૨ના કહામ ૧૩(૧૨) હઠના નિચમ ૩ સાઢે વાંચતા માસ થયેલા અધિકાર મુજળ તા.૧૩-૦૬-૦૧૦ ના રોજ માંગણા નોટિસ ભરી કરેલ હતી, જે અનુસાર બંકના ૠણકર્તા(ઓ)- શ્રી ઇક્ઝાલ કાસમ પશુ (ૠણકર્તા), અને શ્રીમતિ પશુ ફરિદા (સહ ૠણકર્તા) રહેવાસી પ્લોટ ન .૮૧/૧૬, સેટેલાઇટ સીટી, સન સીટી સામે, મોરકડા રોડ પાસે, ભાગગર, ગુજરાત-૩૬૧૦૦૧ ને નોટિસમાં જણાવ્યા મુજળ બૅકના લેણાંની રક્ય રૂ.૧૧,૪૦,૦૧૬.૦૦ (રુપિયા અગિયાર લાખ ચાલિસ હજાર સોળ પૂરા તા.૩૧-૦૫-૨૦૧૯ના રોજ) રૂ. ૧૧, ૪૦,૦૧૬.૦૦ (રુપિયા અગિયાર લાખ ચાલિસ હજાર સોળ પૂરા તા.૩૧-૦૫-૨૦૧૯ના રોજ) તત્તા ત્યાજ, ચાર્જાસ અને તેની પરના અન્ય ખર્ચા તગેરે આ નોટીસ મળવાની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂકવવા જણાવેલ ૠણકર્તા બેંકની લેણી રકમ પરત કરવામાં નિષ્ફળ જવાથી, ખાસ ૠણકર્તાને અને જાહેર જનતાને આથી નોટિસ આપવામાં આવે છે કે -સદર કાયદાની ક્લમ ૧૩(૪)અને દા સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સનેક્ટ) અસ્સ ૨૦૦૦ના નિયમ નં. ૮ સાથે વાંચતા મળેલ રાતાની ૠએ નોચે સહી કરનાર અધિકૃત અધિકારીએ તારીખ ૧૧-૧૧-૨૦૧૯ ના રોજ નીચે જણાવેલ મિલકતાનો કબાએ મેળતી લીધેલ છે. "ૠણકર્તા ને સેક્શન ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ અનુસાર સુરક્ષિત મિલકતોને બચાવવા માટે પ્રાપ્ય થતા સમય અંગે દ્યાના દોરવામાં આવે છે."

ઋછકર્તાને ખાસ અને જાહેર જનતાને સામાન્થતઃ ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકત/મિલકતો સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર કરવો નહી અને તે મિલકત/મિલકતો અંગેનો કોઇપણ પ્રકારનો વ્યવહાર **યુનાઇટેડ બેંક કોફ ઇન્કીયા** ના લેણાં **રૂા.૧૧,૪૦,૦૧૬.૦૦** વત્તા તેની પર ચડતું વ્યાજ વગેરે

स्थावर भिवङतनुं वर्शन :

શ્રી ઇક્લાલ કાસમ પરાની માલિકીની મિલકતનું મોર્ગેજ- ફ્રી હોલ્ડ (૨હેણાંક) લેન્ડ એન્ડ બિલ્ડીંગ, પ્લોટ નં. ૮૧/૧૬, સેટેલાઇ સીટી, આરએસ નં. ૬૬૩, સન સીટી સામે, મોરકંડા રોડ પાસે, જામનગર, પીન-3૬૧૦૦૧. સેલ ડીડ નં.૮૩ તા.૦૫-૦૧ ૨૦૧૭, ક્ષેત્રફળ એરીયા ૪૫.૨૨ ચો.મી. બ્લિટ અપ એરીયા સાથે, કે જેની ચતુઃસીમાઃ

પૂર્વ ૭.૫ મીટર પહોળો રોડ, પશ્ચિમે સબ પ્લોટ નં.૮૧/૭, .. ઉત્તરે સબ પ્લોટ નં.૮૧/૧૭. દક્ષિણે સબ પ્લોટ નં.૮૧/૧૫.

તારીખ : ૧૧-૧૧-૨૦૧૯

#### CIN: L17119GJ1992PLC018073 504, TRIVIDH CHAMBERS, 5th FLOOR, Opp. FIRE STATION, RING ROAD, SURAT-395002, INDIA. Ph.: (91-261) 2328902, FAX: (91-261) 2334189, E-mail: corporate@betexindia.com

BETEX INDIA LIM

| Sr.<br>No. |   | QUARTER<br>ENDED | HALF YEAR<br>ENDED | QUARTER<br>ENDED | (Rs In Lac<br>YEAR<br>ENDED |
|------------|---|------------------|--------------------|------------------|-----------------------------|
| 140.       |   | 30/09/2019       | 30/09/2019         |                  | 31/03/201                   |
|            |   |                  |                    |                  | Audited                     |
| 1.         | Total Income from operations (net)  | 1332.41          | 2634.83            | 1214.12          | 4679.82                     |
| 2.         | Net Profit / (Loss) for the period (before Tax,   |                  |                    |                  | 1                           |
|            | Exceptional and/or Extraordinary items)   | 13.61            | 28.36              | 41.62            | 96.7                        |
| 3.         | Net Profit / (Loss) for the period before tax (after  |                  |                    |                  |                             |
|            | Exceptional and/or Extraordinary items)   | 13.61            | 28.36              | 41.62            | 96.7                        |
| 4.         | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)         | 9.25             | 18.56              | 45.74            | 98.12                       |
| 5.         | Total Comprehensive Income for the period [Comprising   |                  |                    |                  |                             |
|            | Profit / (Loss) for the period (after tax) and Other  | l '              | [ '                |                  | l .                         |
|            | Comprehensive Income (after tax)]   | 9.25             | 18.56              | 45.74            | 98.1                        |
| 6.         | Equity Share Capital  | 150.00           | 150.00             | 150.00           | 150.0                       |
| 7.         | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year |                  |                    |                  | 2076.2                      |
| 8.         | Earnings Per Share (of Rs.10/- each) (for continuing  |                  |                    |                  |                             |
|            | and discontinued operations)  1. Basic :  | 0.62             | 1.24               | 3.05             | 6.5                         |
|            | 2. Diluted :  | 0.02             | 1.2-               | 0.00             | 1                           |

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results for the quarter ended 30th September, 2019, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE: www.bseindia.com and the Company's website: www.betexindia.com.

Place: Surat Date: 13/11/2019 for **BETEX INDIA LIMITED** sd /-MAHESH SOMANI (Chairman)

Half Year Ended

nths ended of 6 months ended of Previous Finance

Year Ended

JINDAL

### JINDAL WORLDWIDE LIMITED

Satellite, Ahmedabad-380 015 • CIN: L17110GJ1986PLC008942 • Ph: 079-71001500 Website: www.jindaltextiles.com • E-mail Id: csjindal@jindaltextiles.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter & Half Year Ended 30th September, 2019

3 months ended

{ Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015} Quarter Ended

Corr. 3 months

Preeceeding 3 months ended of C.Y. ended in P.Y. C.Y. 30th June, 2019 (Un-Audited) 30th Sept., 2018 31st March, 201 30th Sept., 2019 30th Sept., 2018 30th Sept., 2019 **STANDALONE** Total income from operations (net) 39210.49 69256.88 54953.44 108467.37 103499.90 211362.20 Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or 1101.37 Extraordinary items) 1210.08 649.78 2311.45 2504.54 3959.8 Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items). 1101.37 1210.0 649.78 2311.45 3959.8 2504.54 Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items) 1016.35 729.84 350.17 1746.19 1941.19 2639.2 Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after 1016.3 1746.19 2639.2 **Equity Share Capital** 2005.20 2005.20 2005.20 2005.20 2005.2 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st 32555.93 NA NA NA Farnings per share (of Rs. 1/- each)(for continuing and discontinued operations) : 1. Basic : 0.36 0.17 0.87 0.97 2 Diluted 0.51 0.36 0.17 0.87 0.97 1.3 CONSOLIDATED 101716.09 Total income from operations (net) 39046.96 62669.13 58281.53 111362.10 221198.3 2 Net Profit/(Loss) for the period (before Tax Exceptional and/or Extraordinary items) 1169.69 1285.07 1227.69 2454.75 3145.07 4401.2 Net Profit/ (Loss) for the period before tax (after Exceptional 1285.07 1227.69 2454.75 4401.2 and/or Extraordinary items). 1169.69 3145.07 Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items) 1211.14 878.77 2089.91 3067.5 862.52 2511.47 Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (afte 3002.9 1209.93 877.9 777.01 2087.86 2372.86 **Equity Share Capital** 2005.20 2005.20 2005.20 2005.20 2005.20 2005.2 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st 32960.7 Earnings per share (of Rs. 1/- each)(for continuing and 0.60 discontinued operations) : 1. Basic

1. The above Un-audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and half year ended 30th September, 2019 have been reviewed by the Audit Committee and are approved by the Board of Directors on the recommendation of the Audit Committee in the respective Meeting held on 12th November, 2019.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ('Ind-AS') from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 "Interim Financial Reporting" read with reli rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Statements of the Company for the quarter and half year ended 30th September, 2019 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter and hald year ended on 30th September, 2019 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results, alongwith Standalone & Consolidated Limited Review Report

available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltextiles.com For, Jindal Worldwide Limited Sd/- (Dr. Yamunadutt Agrawal) Chairman & Director

GYSCOAL ALLOYS LIMITED

અધિકૃત અધિકારી યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા

Registered Office: Plot No. 2/3, GIDC, Ubkhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana 382830 Gujarat Cor.Off.: 2<sup>nd</sup> Floor, Mrudul Tower, B\H. Times of India, Ashram Road, Ahmedabad-380009 Gujarat. India CIN: L27209GJ1999PLC036656 website: www.gyscoal.com Email: info@gyscoal.com Phone: +91-079-66614508, +91-2763-252384 Fax: +91-079 - 26579387

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND HALF YEAR ENDED ON 30™ SEPTEMBER. 2019

|            | AND HALF TEAR ENDED ON 30 SEFTEMBER, 2019 |             |               |             |             |             |            |  |  |  |
|------------|---|-------------|---------------|-------------|-------------|-------------|------------|--|--|--|
|            | (₹ In Lacs Except EPS )                   |             |               |             |             |             |            |  |  |  |
| [~         |   |             | Quarter Ended | d           | Half Yea    | Year Ended  |            |  |  |  |
| Sr.<br>No. | Particulars                               | 30-09-2019  | 30-06-2019    | 30-09-2018  | 30-09-2019  | 30-09-2018  | 31-03-2019 |  |  |  |
| INO.       |   | (Unaudited) | (Unaudited)   | (Unaudited) | (Unaudited) | (Unaudited) | (Audited)  |  |  |  |
| 1          | Total Income From Operations              | 1,850.47    | 1,936.47      | 3,999.37    | 3,786.94    | 6,936.50    | 14,790.30  |  |  |  |
| 2          | Net Profit / (Loss) before tax            | (656.62)    | (533.43)      | (445.23)    | (1,190.05)  | (959.01)    | (2,152.87) |  |  |  |
| 3          | Net Profit / (Loss) after tax             | (608.33)    | (484.64)      | (475.83)    | (1,092.97)  | (926.87)    | (2,029.82) |  |  |  |
| 4          | Total Comprehensive Income                | (608.33)    | (484.64)      | (475.83)    | (1,092.97)  | (926.87)    | (2,061.92) |  |  |  |
|            |   |             |               |             |             |             | _          |  |  |  |

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND HALF YEAR ENDED ON  $30^{\rm TH}$  SEPTEMBER, 2019

|     | (₹ In Lacs Except EP  |             |               |             |             |             |            |  |
|-----|---|-------------|---------------|-------------|-------------|-------------|------------|--|
| Sr. |   |             | Quarter Endec | l           | Half Yea    | Year Ended  |            |  |
| No. | Particulars   | 30-09-2019  | 30-06-2019    | 30-09-2018  | 30-09-2019  | 30-09-2018  | 31-03-2019 |  |
| L'' |   | (Unaudited) | (Unaudited)   | (Unaudited) | (Unaudited) | (Unaudited) | (Audited)  |  |
| 1   | Total Income From Operation   | 1,850.47    | 1,936.47      | 3,999.37    | 3,786.94    | 6,936.50    | 14,790.30  |  |
| 2   | Net Profit / (Loss) for the period (before tax and exceptional items) | (656.62)    | (533.43)      | (445.23)    | (1,190.05)  | (959.01)    | (1,586.13) |  |
| 3   | Net Profit/(Loss) for the period before Tax (after exceptional items) | (656.62)    | (533.43)      | (445.23)    | (1,190.05)  | (959.01)    | (2,152.87) |  |
| 4   | Net Profit for the period after tax (after Exceptional items)         | (608.33)    | (484.64)      | (475.83)    | (1,092.97)  | (926.87)    | (2,029.82) |  |
| 5   | Total Comprehensive Income for the period [Comprising Profit for the  | (608.33)    | (484.64)      | (475.83)    | (1,092.97)  | (926.87)    | (2,061.92) |  |
|     | period (after tax) and Other Comprehensive Income (after tax)]        |             |               |             |             |             |            |  |
| 6   | Paid up Equity Share Capital (Face Value of Rs1/- each)               | 1,582.76    | 1,582.76      | 1,582.76    | 1,582.76    | 1,582.76    | 1,582.76   |  |
| 7   | Earning per Share - Not Annualised (in Rs)                            |             |               |             |             |             |            |  |
|     | (for continuing and discontinued operations) not annualised           |             |               |             |             |             |            |  |
| l   | (a) Basic (in Rs.)  | (0.38)      | (0.31)        | (0.30)      | (0.69)      | (0.59)      | (1.30)     |  |
| l   | (b) Diluted (in Rs.)  | (0.38)      | (0.31)        | (0.30)      | (0.69)      | (0.59)      | (1.30)     |  |

Notes:

The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results and its release at their respective meetings held or 13<sup>th</sup> November, 2019.

The statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companie Act, 2013 and other recognized accounting practice and policies to the extent applicable.

The Company is engaged in the business of manufacturing of S.S. Products. As there is only one reportable segment, the company has not given segment information. Total numbers of Investor complaints received and resolved were NIL. Complaints left unattended as on 30th September, 2019 is Nil.

The figures for the corresponding previous period have been regrouped/reclassified wherever necessary, to make them comparable.

For and on behalf of Gyscoal Alloys Limited

Viral M. Shah

Managing Director DIN - 00014182

Date: 12th November, 2019

Place: Ahmedabad

Date: 13-11-2019 Place : Ahmedabad